

May 24, 2024

To, BSE Limited Corporate Relationship Department Phiroze Jeejeebhoy Towers, Dalal Street, Mumbai – 400001.

BSE Scrip Code: **515085** ISIN: **INE298E01022** 

### <u>Subject: Newspaper Advertisement of Audited Standalone Financial Results for the quarter and financial year</u> ended on March 31, 2024

Dear Sir/Madam,

Pursuant to Regulation 47 of the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, please find enclosed the copies of newspaper advertisement of the Audited Standalone Financial Results of the Company for the quarter and financial year ended on March 31, 2024 published in the following newspapers:

- 1. Financial Express (English Language) on Friday, May 24, 2024.
- 2. Financial Express (Gujarati Language) on Friday, May 24, 2024.

The above information is also available on the website of the Company at www.restile.com

You are requested to take the above information on your records and oblige.

Thanking you,

Yours faithfully, For Restile Ceramics Limited



Palak Kumari Company Secretary and Compliance Officer Membership No. A69959

Encl: as above

### RESTILE CERAMICS LIMITED

Regd. Office : 204, Sakar Complex, Opp. ABS Tower, Vaccine Crossing, Old Padra Road, Vadodara, Gujarat - 390015, India. CIN : L26931GJ1986PLC102350

Branch Office : D.No.1-10-77, 5th Floor, Varun Towers, Opp. Hyderabad Public School, Begumpet, Hyderabad - 500 016. E-mail : restile@accountscare.com, works@restile.com, Website : www.restile.com ph. No. 9998219763

I Granamite | Mirrorstone | PearlRock | MarboGranit | Impacta | Gripmax

# **FINANCIAL EXPRESS**

AU SMALL FINANCE BANK LIMITED (A Scheduled Commercial Bank) Regd. Office: 19-A, Dhuleshwar Garden, Ajmer Road, Jaipur - 302001 (CIN:L36911RJ1996PLC011381) APPENDIX IV [SEE RULE 8(I)] POSSESSION NOTICE

Whereas, The undersigned being the Authorized Officer of the AU Small Finance Bank Limited (A Scheduled Commercial Bank) under the "Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest [Act, 2002 (54 of 2002)] and in exercise of powers conferred under section 13 (12) read with rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002 issued demand notice on the date as mentioned below calling upon the borrowers to repay the amount mentioned in the said notice within 60 days from the date of receipt of the said notice as per the details given in below table: -

Name of Borrower/Co-Borrower/ Mortgagor/Guarantor/Loan A/c No.	13(2) Notice Date & Amount	Description of Mortgaged Property	Date of Possession Taker	
(Loan A/C No.) L9001060100025920, Jagdish Bhai Gangwani (Borrower) , Smt.Gangwani Jaywanti (Co-Borrower)	04-Dec-23 ₹14,51,392/- Rs. Fourteen Lac Fifty-One Thousand Three Hundred Ninety-Two Only as on 01-Dec-23	All That Part And Parcel Of Residential/Commercial Property Land / Building / Structure And Fixtures Property Situated At- Shop No. 101,Mezzanine Floor Lodhawala Comlex,Kalupur-Ahmedabad Gujarat Admeasuring 221 Sq.Ft.	18-May-24	
(Loan A/C No.) L9001060115506131, Patel Tulsibhai Vitthaldas (Borrower), Smt.Lilaben Tulsibhai Patel (Co- Borrower), Niteshkumar Tulshibhai Patel (Co-Borrower)	12-Jan-24 ₹2,99,072/- Rs. Two Lac Ninety-Nine Thousand Seventy-Two Only as on 10-Jan-24	All That Part And Parcel Of Residential/Commercial Property Land / Building / Structure And Fixtures Property Situated At Gram Panchayat 3/135 Ramji Mandir Gandhi Nagar ,Dist-Mansa,Gujarat Admeasuring 97.78 Sqyds	18-May-24	
(Loan A/C No.) L9001060116903633, Kantodiya Gokul Kanabhai (Borrower), Smt.Vaniben Gokulbhai Kantodiya (Co- Borrower),		All That Part And Parcel Of Residential/Commercial Property Land / Building / Structure And Fixtures Property Situated At R S No 1936/1, Plot No 19/P, Sub Plot No. 4/P, T.P.S. No. 02, O.P. No. 03, F.P. No. 9/P, Taluka- Wadhwan, Dist Surendra Nagar, Gujarat Admeasuring 50 Sq. Mtr. East - Property Of Magan Bhai , West - Road , North Sub Plot No. 03 , South - Property Of Maganbhai	20-May-24	

possession of the property described herein above mentioned table in exercise of powers conferred on him/her under section 13(4) of the said [Act 2002] read with Rule 8 of the said rule on the date mentioned in the above table.

'The borrower's attention is invited to provisions of sub section (8) of section 13 of the Act, in respect of time available, to redeem the secured assets." The borrower in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of the AU Small Finance Bank Limited (A Scheduled Commercial Bank) for the amount and interest thereon mentioned in the above table. Place : Ahmedabad

Date : 23/05/2024

Authorised Officer AU Small Finance Bank Limited

Central Bank of India

સેન્ટ્રલ બેંક ઑફ ઇન્ડિયા

1 if smit by "siler" CENTRAL TO YOU SINCE 1911



BRANCH: NOTICE UNDER SECTION Ashram Road Branch, 13(2) OF SARFAESI ACT-2002 Ahmedabad

A Notice is hereby given that following Borrower Mrs. Saleha Keshav Anand, have defaulted in the repayment of principal and interest of the loan facility obtained i.e. Cent Swabhiman Plus in the name of Mrs. Saleha Keshav Anand, by them from the Bank and Ioan has been classified as Non Performing Assets (NPA). The Notice was issued to them under section 13(2) of Securitization and Re-construction of Financial Assets and Enforcement of Security Interest Act - 2002 on their last known addresses, but it has been returned with remarks " Undelivered" and as such they are hereby informed by way of this public notice.

		Nam	e & Address o	f the Borrower		
1. Mrs. Saleha Kes Address: A/56, fifth		an Tower, Nr. Prerna	dirth - 2, Derasa	r, Jodhpur Gaam, Sat	ellite, Ahmedabad	-380015.
	LOAN DETAILS				Demand	Due Amount
TYPE OF LOAN	ACCOUNT NO.	LOAN AMOUNT	RATE OF	DUE AMOUNT AS ON 22/05/2024	Notice Date	Rs. 4213976.50/- + interest from
Cent	3101988222	14,92,000/-			22/05/2024 Date of NPA	22/05/2024 per annum
Swabhiman Plus	TOTAL	14,92,000/-		4213976.50/-	09/11/2023	with monthly rests

### 🕼 ) बैंक ऑफ़ बड़ौदा Pal Branch : Royal Platinum, Shop No. 4-7, Palanpur Gam, Bank of Baroda Canal Road, Surat - 395009, Phone No. 0261-2777734/35 C 1100 110 200 (M): 8980026753, E-mail: surpal@bankofbaroda.com

## POSSESSION NOTICE (For Immovable Properties)

Whereas, The undersigned being the authorized officer of the Bank of Baroda under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 (54 of 2002) and in exercise of powers conferred under Section 13(12) read with rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002 issued a demand notice dated calling upon the borrowers to repay the amount mentioned in the notice being the amount with further interest and cost etc. within 60 days from the date of receipt of the said notice.

The Borrowers having failed to repay the amount, notice is hereby given to the Borrower and the public in general that the undersigned has taken Symbolic Possession of the properties described herein below in exercise of powers conferred on him under sub-section (4) of section 13 of Act read with rule 8 of the Security Interest Enforcement) Rules, 2002 on this below mentioned date.

The Borrower in particular and the public in general is hereby cautioned not to deal with the properties and any dealings with the properties will be subject to the charge of Bank of Baroda, Pal Branch, Surat. The Borrower's attention is invited to provisions of subsection (8) of section 13 of the Act, in respect of time available, to redeem the secured assets.

Sr. No.	Borrower's Name	Demand Notice Date & Amount (Rs.)	Description of the Properties	Date of Possession
1.	Mr. Vijay Rakeshbhai Gupta, Ajay Rakeshbhai Gupta & Nisha Vijay Gupta (Borrower)	09.02.2024 Rs. 13,00,389.74 plus Interest and Other Charges thereon	Residential Property situated at R.S. No. 6/A, Block No. 7/A, Plot No. 20, Madhav Park, Near Tundi Branch Post Office, Off. Tundi Ena - Palsana Road, District - Surat, Gujarat - 394345, Total Area 60.39 Sq. Mtrs. Bounded by :- North : Plot No. 19, South : Plot No. 21, East : Society Road, West : Plot No. 35.	22.05.2024 (Symbolic)
2.	Mr. Deelipkumar Manikchand Bind Ə Mrs. Priyanka Deelipkumar Bind (Borrower)	12.03.2024 ————————————————————————————————————	Residential Property Plot No. 33, Rahi Township Vibhag - 5, Near Rudraksh Residency, RS No. 1, Block No. 1, Moje : Kareli, Palsana, Taluka - Palsana, Surat - 394315, Gujarat. Bounded by :- North : Soceity Internal Road, South : Plot No. 13, East : Society Boundary, West : Plot No. 32,	23.05.2024 (Symbolic)

**Bharuch Branch** : इंडियन बेंक 🚲 Indian Bank 25-27, Golden Plaza, M.G. Road, BSNL Office, Bharuch - 392001 A इलाहाबाद ALLAHABAD DEMAND NOTICE Notice under Sec. 13(2) of the Securitization and Reconstruction of **Financial Assets and Enforcement of Security Interest Act, 2002** Date : 01.05.2024 (1). Mrs. Makvana Rupalben Jayeshbhai (Borrower & Mortgagor) (2). Mr. Makwana Jayeshbhai Balubhai (Co-Borrower & Mortgagor) Address : Plot No. 23-B, Ashok Vatika, Near Residency, Moje - Andada, Taluka - Ankleshwar, District - Bharuch. Address : S/o Mr. Makwana Bhalubhai, NOTICE UNDER SECTION B-7, Nilam Nagar, Nandelav (CT), Bharuch. Your Ioan - Housing Term Loan - 58004134611 13(2) OF SARFAESI ACT-2002 with Indian Bank Bharuch Branch - Reg. The first and second of you are the borrowers of the loan account. A Notice is hereby given that following Borrower 1. MR ASHITH RANJAN BANERJEE (BORROWER), have defaulted in the repayment of principal The 1" & 2" of you is the mortgagor having offered your assets as securities to and interest of the loan facility obtained i.e. Cent Swabhiman Plus Loan in the name of 1. MR ASHITH RANJAN BANERJEE (BORROWER), by the Loan /facility availed by the 1" &2'" of you. them from the Bank and loan has been classified as Non Performing Assets (NPA). The Notice dated 09.05.2024 was issued to them under section 13(2) of Securitization and Re-construction of Financial Assets and Enforcement of Security Interest Act - 2002 on their last known addresses, but it At the request of the 1" 62" of you, in the course of banking business, the ollowing facilities were sanctioned and were availed by 1° & 2" of you. Balance as on 30.04.2024 Nature of Limit Present Rate 1. MR ASHITH RANJAN BANERJEE (BORROWER), ADDRESS ; FLAT NO : N-002, BLOCK N, GROUND FLOOR, INDRAPRAST-Facility (Rs.) Principal MOI Total Dues of Interest (SUVIDHANAGAR COHSL VIBHAG -2, NR, HIMALAYAMALL, NR DRIVE IN CINEMA, DRIVE IN ROAD, MEMNAGAR, AHMEDABAD -380052 HOME LOAN **Due Amount** 20,00,000/- 17,25,911/- 68,817.75 17,94,728.75 A/c No. 9.35% Rs. 12441164.92/-58004134611 is due to us as on 22.05.2024 plus interest The First, Second, Third and Fourth of you have executed the following documents for per annum with monthly Housing Term Loan rests. Nature of Nature of Documents Facility EQUITABLE MORTGAGE OF PROPERTY CONSISTING OF APARTMENT RESIDENTIAL FLAT HOUSE IN THE NAME OF MR ASHITH RANJAN

DETAILS OF SECURED ASSETS

EQUITABLE MORTGAGE OF PROPERTY CONSISTING OF RESIDENTIAL FLAT IN THE NAME OF MRS. SALEHA KESAHV ANAND, FLAT NO. A/56, 5TH FLOOR, SHUBHADARSHAN APARTMENT, NR. PRERNATIRTH - 2, NR. PRERNATIRTH DERASAR, B/H. ISRO, JODHPUR GAAM, SATELLITE, AHMEDABAD - 380015, 691/2, TPS - 4, MOUJE VEJALPUR, F.P.NO - 116/2, MOUJE VEJALPUR, AHMEDABAD, GUJARAT, ADMEASURING AREA 78.64 SQ. MTETER, BOUNDED BY: EAST: LIFT, WEST: FLAT NO A-55, NORTH: MARGIN LAND, SOUTH: COMMON PASSAGE AND FLAT NO A-54

The steps are being taken for substituted service of notice, the above Borrower is hereby called upon to make payment of outstanding amount within 60 days from the date of publication of this notice, failing which further steps will be taken after expiry of 60 days from the date of this notice. under Sub-section (4) of Section 13 of Securitization and Re-construcation of Financial Assets and Enforcement of Security Interest Act. 2002.

Place : Ahmedabad

Sd/- Authorised Officer, Central Bank of India

# **RESTILE CERAMICS LIMITED**

Reg office: 204, Sakar Complex, Opp ABS tower, Vaccine Crossing, Old Padra Road, Vadodara, Gujarat-390015 CIN:L26931GJ1986PLC102350 EXTRACT OF AUDITED FINANCIAL RESULTS FOR THE YEAR ENDED MARCH 31, 2024

[See Regulation 47(1)(b) of the SEBI (LODR) Regulations, 2015] Rs. in Lakhs

Sr.		C	Quarter Ende	Year Ended		
ər. No.	Particulars	31-Mar-24	31-Dec-23	31-Mar-23	31-Mar-24	31-Mar-23
_	-	1	Unudited		Au	dited
1.	Total Income from Operations	20.40	18.67	53.33	93.88	197.12
2.	Net Profit/(Loss) for the period (Before Tax and/or Exceptional items)	(28.62)	(11.05)	(36.77)	(91.10)	(66.85)
3.	Net Profit/(Loss) for the period before Tax (after Exceptional items)	(28.62)	(11.05)	(36.77)	(91.10)	(66.85)
4.	Net Profit/(Loss) for the period after Tax (after Exceptional items)	(28.62)	(11.22)	(36.77)	(91.27)	(66.85)
5.	Total Comprehensive Income for the period [Comprising Profit/(Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	(28.32)	(11.35)	(36.35)	(90.82)	(66.28)
6.	Equity Share Capital	9827.92	9827.92	9827.92	9827.92	9827.92
7.	Other Equity as shown in the Audited Balance Sheet				(12,898.91)	(12,808.09)
8.	Earnings per share (of Rs. 10/- each) for continuing operations-(not annualised) 1. Basic: 2. Diluted:	(0.03) (0.03)	(0.01) (0.01)	(0.04) (0.04)	(0.09) (0.09)	(0.07) (0.07)

The above is an extract of the detailed format of Financial Results Filed with the Stock Exchange under Regulation 33 of SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of the Financial Results are available on the Stock Exchange website (www.bseindia.com) and the Company's web site (www.restile.com)

For and on behalf of the Board of Directors sd/-

Viren Rathod

Managing Director

Place: Chennai Date: 23 May, 2024

> Home First Finance Company India Limited CIN: L65990MH2010PLC240703.

Website: homefirstindia.com Phone No.: 180030008425 Email ID: loanfirst@homefirstindia.com

## APPENDIX- IV-A [See proviso to rule 8 (6)] SALE NOTICE FOR SALE OF IMMOVABLE PROPERTIES

E-Auction Sale Notice for Sale of Immovable Assets under the Security Interest (Enforcement of Security Interest Act, 2002 read with proviso to Rule 8 (6) of the Security Interest (Enforcement) Rules, 2002

Notice is hereby given to the public in general and in particular to the Borrower (s) and Co-Borrower (s) as per column (ii) that the below described immovable properties as per column (iii) mortgaged/charged to the Secured Creditor, the physical possession of which has been taken by the Authorised Officer of Home First Finance Company India Limited for realization of its dues plus interest as detailed hereunder and whereas consequent upon failure to repay the dues, the undersigned in exercise of power conferred under Section 13(12) of the said Act proposes to realize dues by sale of the said propertyles and it will be sold on "As is where is", "As is what is", and "Whatever there is" as described hereunder. The auction will be conducted "On Line", for the recovery of amount due from Borrower (s) and Co-Borrower (s) as per column (i), due to Home First Finance Company India Limited.

S. No.	Name Borrower (s) and Co-Borrower (s)		PROPERTY ADDRESS	Date of Demand Notice	Demand Notice Amount	Date of Possession	Reserve Price	EMD Amount	Date and Time of Auction	Last Date & Time of Submission Of Emd & Documents	Number of Authorised officer
1.	Bhavesh Devjibhai kakkad, Bhavnaben Bhaveshbhai kakkad,		h Labhnagar 2 ,RS NO 139/3P1 gar 2 Mahendranagar Morbi Gujarat	04-03-2024	9,78,897	08-05-2024	9,65,000	96,500	24-06-2024 (11am-2pm)	22-06-2024 (upto 5pm)	7878291661
2.	Shalini Kadam, Vinayak Kadam	Row house no -80, Mahek Residen tal olpad dist surat, Gujarat, 394130	cy, block no 42, 43, 44 moje madhar	03-02-2024	10,50,958	17-05-2024	8,87,377	88,738	24-06-2024 (11am-2pm)	22-06-2024 (upto 5pm)	6355473128
3.	Nirama Devi, Ramsamujh Janjali Nishad	Flat no -303, Shree Hari Residency Moje: Jolva, Tal: Palsana, Surat, Gu		04-12-2023	7,50,031	18-05-2024	4,00,295	40,030	24-06-2024 (11am-2pm)	22-06-2024 (upto 5pm)	6355473128
4.	Sunitaben Thakor, Vinodkumar M Singh	Plot no-86, Maa Bhavani Residenc Olpad Dist:Surat, Gujarat, Pincode-	y, Block No. 103@ Moje: Sivan Ta: 394130	03-10-2023	14,33,234	19-05-2024	13,30,080	1,33,008	24-06-2024 (11am-2pm)	22-06-2024 (upto 5pm)	6352844771
5.	Soniya Devi, Khiru Sah	Comparison of the State of the Comparison o Comparison of the Comparison of the C	PLOT NO 25,26,27,48849 BLOCK DWN -4 MOJE JOLVA TA PALSANA	06-05-2023	3,30,088	18-05-2024	3,03,800	30,380	24-06-2024 (11am-2pm)	22-06-2024 (upto 5pm)	8000073408
6.	Arun Kumar, JYOTI	Arun Kumar, JYOTI Flat -TF-5, Building Name-Krishna Vatika, ple SUDAMAPURI COLONY, VILLAGE DUNDA TEHSIL Ghaziabad Uttar Pradesh 201006		06-02-2023	10,82,555	21-05-2024	11,95,375	1,19,538	24-06-2024 (11am-2pm)	22-06-2024 (upto 5pm)	7011789295
E-	Auction Service Provider		E-Auction Website/For Details, Other terms & conditions	100000000000000000000000000000000000000	o: for deposit other amount			Bra Cor	nch IFSC le	Name of Beneficiary	
Hel Cor	lp Line No .:079-35022160 / 149 ntact Person : Ram Sharma -80		http://www.homefirstindia.com https://homefirst.auctiontiger.net	912020036268117- Home First Finance Company India Limited - Axis Bank Ltd., MIDC, Andheri East.		UTIB0000395		Authorized Officer, Home First Finance Company India Limited			
Gene indep comr	eral Terms & Conditions of online pendent inquiries regarding the e mitment or any representation of	e auction sale are available at Portal incumbrances, title of property/ies put Home First. The property is being sol	signed through e-auction platform prov Site. To the best of knowledge and int on auction and claims/ rights/ dues/ aff d with all the existing and future encum prescribed under the securitization an	ormation of the ecting the prope brances whethe	Authorized Of rty, prior to sub er known or uni	ficer, there is no mitting their bid. known to Home P	encumbrance The e-Auction Irst. The Auth	on the proper advertisemen orised Officer/	ties. However, th t does not constit Secured Creditor	e intending bidders shouk ute and will not be deemed	d make their ow to constitute an
	and the second of the second second second		STATUTO	RY 30 Days	SALE NOT	ICE UNDER	THE SARF	AESI ACT,	2002		
any, v	borrower/ guarantors are hereby will be recovered with interest an e: 24-05-2024 Place: Gujarat		STATUTC d in the demand notice along with upto		epolitica da la competitica.		edate of e-Auc	tion, failing wh	ich the property	will be auctioned/ sold and me First Finance Compar	

BANERJEE, FLAT NO N-002 ,GROUND FLOOR, INDRAPRSTH (SUVIDHA NAGAR COHSL VIBHAG-2 NR HIMALAYA MALL, NR DRIVE – IN CINEMA; DRIVE -- IN ROAD, AHMEDABAD -380052, NEW HARSHAD BHAVANI CO-OPERATIVE HSG SOCIETY LTD, TPS-2, F.P. NO -123 ; MOUJE MEMNAGAR (MEMNAGAR) AHMEDABAD, GUJRAT ADMEASURING AREA 146.306 SQ. METERS, BOUNDED BY: EAST: MARGIN LAND AND HIMALAYA MALL, WEST: BOW HOUSE NO -COMMON PASSAGE STAIRS AND HALLOW PLINTH, NORTH: FLAT NO N-001, SOUTH: MARGIN LAND AND BLOCK NO P

**DETAILS OF SECURED ASSETS** 

BRANCH:

Ashram Road Branch,

Ahmedabad

Name & Address of the Borrower

INTEREST

40.20.000/- 9.10 % p.a. 12441164.92/-

RATE OF DUE AMOUNT AS INTEREST ON 22/05/2024

12441164.92/-

has been returned with remarks " Undelivered" and as such they are hereby informed by way of this public notice.

LOAN DETAILS

40.20.000/-

ACCOUNT NO. LOAN AMOUNT

3138853009

TOTAL

TYPE OF LOAN

CENT Swabhiman

Capital

Name of the Borrower /

**Co-Borrower/ Guarantor/** 

Loan Account No/

Old Loan Account No.

Daudbhai Hasanbhai

Bhatti /Jubedaben

Daudbhai Bhatti

100MSM001104155/

BHABLS000014826

without our consent.

Place : GUJARAT

Date : 24.05.2024

Plus LOAN

The steps are being taken for substituted service of notice, the above Borrower is hereby called upon to make payment of outstanding amount within 60 days from the date of publication of this notice. failing which further steps will be taken after expiry of 60 days from the date of this notice under Sub-section (4) of Section 13 of Securitization and Re-construcation of Financial Assets and Enforcement of Security Interest Act, 2002. Place : Ahmedabad

**Adani Capital Private Limited** 

CIN: U65990GJ2016PTC093692, Website : www.adanicapital.in

DEMAND NOTICE UNDER SECTION 13(2) OF THE SARFAESI ACT, 2002

You the below mentioned Late borrower through its Legal Heirs), co-borrower(s) / have availed loan/s facility(ies) from Adani

Capital Private Limited. (the "ACPL") by mortgaging your immovable properties (Securities). Consequent to your defaults

your loans were classified as non-performing assets. Adani Capital Pvt. Ltd. For the recovery of the outstanding dues, issued demand notice under Section 13(2) of The Securitization and Reconstruction of Financial Asset and Enforcement

of Security Interest Act, 2002 (the Act), the contents of which are being published herewith as per Section 13(2) of the Act

read with rule 3(1) of the Security Interest (Enforcement) Rules, 2002 as and by way of service upon you. Details of the

Late borrower through its Legal Heirs, co-borrowers, properties mortgaged, outstanding dues, demand notice sent under

Mortgage Property Address

All that pieace and parcel of land along with structure standing there on

being The residential property situated at Wagra Ta. Wagra Dist Bharuch

Re Su No. 210 211 223 Paiki Plot No. B-5 Adm area 138.75 Sq. mtrs Plot

No. B-6adm area 60.00 Sq. mtrs Bounded as East - Society Road West

- Plot No. A/10 North - Plot No. B/7 South - Plot No. B/4

You the borrower/s and co-borrowers/Legal Heirs are therefore called upon to make payment of the above mentioned

demanded amount with further interest as mentioned hereinabove in full within 60 days of this notice failing which the undersigned shall be constrained to take action under the act to enforce the above-mentioned securities. Your

attention is invited to provisions of sub-section (8) of section 13 of the act by virtue of which you are at liberty to

redeem the secured asset within period stipulated in the aforesaid provision. Please note that as per section 13(13)

of the said act, you are restrained from transferring the above-referred securities by way of sale, lease or otherwise

Bandra (East), Mumbai 400 051, Maharashtra, India,

Section 13(2) and amount claimed there under are given as under:

Sd/- Authorised Officer, Central Bank of India

**Demand Notice** 

Date /

O/s Amount /

O/s Date

Rs. 2234907/-

For Adani Capital Private Limited

Sd/-

Authorised Officer

15-May-24

As on Date

15-May-24

Registered Office : Adani House, 56, Shrimali Society, Navrangpura, Ahmedabad 380 009, Gujarat, India Corporate Office : 1004/5, 10th Floor, C-Wing, One BKC, C-66, G- Block, Bandra Kurla Complex,

Demand

Notice Date

22/05/2024

Date of NPA

21/02/2022

н	HOUGHING LOAN	(1). Demand Promissory Note dated 09/10/2020
L	HOUSING LOAN	(2). Sanction Acknowledgement letter dated 09/10/2020
I	A/C No.	<ol> <li>(1). Demand Promissory Note dated 09/10/2020</li> <li>(2). Sanction Acknowledgement letter dated 09/10/2020</li> <li>(3). Registered Mortgaged Deed No. 8647 dated 22.10.2020</li> <li>(4). Sale Deed No: 8306 dated 16/10/2020</li> </ol>
L	58004134611	(4). Sale Deed No: 8306 dated 16/10/2020

The repayment of the said facility is secured by registered mortgage of property at "Old Survey No. 115/1, New Survey No. 125/1, Paiky Plot (House) No23-B, admeasuring 65.05 Sq.Mtr in land below in building know as Ashok Vatika, Near Mahalaxmi Residency, Moje Andada, Taluk Ankleshwar, District Bharuch" schedule belonging to 1" & 2" of you."

Despite repeated requests calling upon you to pay the amounts together with interest, all of you and each of you who are jointly and severally liable have failed and committed default in repaying the amount due. The Loan account - Housing Term Loan (A/c: 58004134611 have been classified as Non-Performing Asset since 29.04.2024 in accordance with directions/guidelines relating to asset classifications issued by Reserve Bank of India.

The outstanding dues payable by you as on 30.04.2024 amounts to Rs. 17,94,728.75 (Rupees Seventeen Lakh Ninety Four Thousand Seven Hundred Twenty Eight and Paisa Seventy Five only) from your Housing Loan Account: 58004134611 the said amount carries further interest at the agreed rate from 01.05.2024 till date of repayment.

The term borrower under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act 2002 means any person who has been granted financial assistance by Bank or who has given any guarantee or created any mortgage / created charge as security for the said financial assistance granted by the Bank.

Therefore, all of you and each of you are hereby called upon to pay the dues as on 30.04.2024 amounting to Rs. 17.94,728.75 (Rupees Seventeen Lakh Ninety Four Thousand Seven Hundred Twenty Eight and Paisa Seventy Five only) together with interest from 01.05.2024 till date of payment within 60 days from the date of this notice issued under Sec.13(2) failing which Bank will be constrained to exercise its rights of enforcement of security interest without any further reference to you under the said Act. If you fail to discharge your liabilities in full within 60 days from the date of this notice, Bank shall be exercising its enforcement rights under Sec 13 (4) of the Act as against the secured assets given in the schedule hereunder.

On the expiry of 60 days from the date of this notice and on your failure to comply with the demand, Bank shall take necessary steps to take possession for exercising its rights under the Act.

Please note that as per the provisions of Sec. 13 (13) of the Act no transfer of the secured assets (given in the schedule hereunder) by way of sale, lease or otherwise, shall be made after the date of this notice without the prior written consent of the bank.

Needless to mention that this Notice is addressed to you without prejudice to any other remedy available to the Bank.

We draw attention to the provisions of Section 13(8) of the SARFAESI Act and the Rules framed there under which deals with your rights of redemption over the securities"

The undersigned is aduly Authorized Officer of the Bank to issue this Notice and exercise powers under Section 13 aforesaid.

SCHEDULE :- The specific details of the assets in which security interest is created are enumerated hereunder:

Schedule A :- All that piece and parcels of free hold immovable property (Flat) situate at Old Survey No. 115/1, New Survey No. 125/1, Paiky Plot (House) No23-B, admeasuring 65.05 Sq.Mtr in land below in building knew as Ashek Vatika, Near Mahalaxmi Residency, Moje Andada, Taluk Ankleshwar, District Bharuch in the name of Mrs. Makwana Rupalben Jayeshbhai and Mr. Makwana Jayeshbhai Bhalubhai. Bounded by :- North : Adj. Society Road, South : Adj. Plot No. 23-C, East : Adj. Plot No. 22-A, West: Adj. Plot No. 23-A.

Date : 01.05.2024	Authorised Officer,
Place : Bharuch	Indian Bank
a loss of the second second second second	











# ચાલુ વર્ષમાં બેવડા આંકના સેલ્સ ગ્રોથની અપેક્ષા : મર્સિડિઝ-બેન્ઝ

### પીટીઆઈ

B

ALAE

નવી દિલ્હી, તા. ૨૩ માગ મજબૂત થતાં ચાલુ નાણાંકીય વૃદ્ધિ નોંધાઈ હતી. વર્ષમાં બેવડા આંકની વેચાણ વૃદ્ધિ હતાં. ગત નાણાંકીય વર્ષમાં પ્રેસિડેન્ટ (સેલ્સ એન્ડ માર્કેટિંગ) એસ ૬૩ ઈ પર્ફોર્મન્સની કિંમત રૂ

FINSERV

વેચ્યાં હતાં.૨૦૨૨-૨૩માં કરીને હાઈ-એન્ડ મોડેલ્સ માટેની હતું, તે જોતાં તેમાં ૧૦ ટકાની પર ધ્યાન આપી રહી છે.

સિક્યોરીટાઇઝેશન અને રીકન્સ્ટક્શન ઓક કાયનાન્સિયલ એસેટસ અને એન્કોર્સમેન્ટ ઓક સિક્યોરીટી ઇન્ટરેસ્ટ એક્ટ, ૨૦૦૨ની

બજાજ હાઉસિંગ કાચનાન્સ લીમીટેડ

કોપોરેટ ઓફીસ : કેટેબ્રુમ આઇટી પાર્ક બીર બિલ્ડીંગ પાંચમો માળ, કલ્શાણી નગર, પુણે, મહારાષ્ટ્ર-૪૧૧૦૧૪. શાખા ઓફીસ : ચોથો માળ, ઔરમ એવન્યુ, મેચર બંગલોઝ સામે, લૉ ગાર્ડન પાસે, એલિસબ્રિજ, અમદાવાદ–૩૮૦૦૦દૃ

કબજા નોટીસ

કંપનીએ ૧૮,૧૨૩ યુનિટ્સ લાન્સ બેનેટે જણાવ્યું હતું.

તરફ મીટ માંડી રહી છે. કંપનીએ પણ બેવડા આંકની વેચાણ વૃદ્ધિની વેચાણ થયેલી પ્રત્યેક ચાર કાર બુધવારે તેનાં લક્ઝરી મોડેલ્સ - અપેક્ષા સેવી રહ્યાં છીએ. કંપનીના પૈકી એક ટીઈવી સેગમેન્ટને કાર મેબેક જીએલએસ ૬૦૦ ૪મેટિક ટોપ-એન્ડ વ્હીકલ્સ (ટીઈવી) હતી.નવી મેબેક જીએલએસ એસયુવી તથા એએમજી એસ ૬૩ માટેની માગ મજબૂત રહી છે, એમ ૬૦૦ ૪મેટિકની કિંમત રૂપિયા ઈ પર્ફોર્મન્સ એડિશન ૧ રજૂ કર્યાં મર્સિડિઝ બેન્ઝ ઈન્ડિયાના વાઈસ ૩.૩૫ કરોડ છે, જ્યારે એએમજી

પિયા ૨૦૨૪ના પ્રથમ ગાળા

કબજાની

તારીખ

૨૧.૦૫.૨૦૨૪

3.3 અમે ચાલુ નાણાંકીય વર્ષમાં દરમિયાન ભારતમાં મર્સિડિઝની માગને પગલે ટીઈવી સેગમેન્ટ જણાવ્યું હતું.

કરોડ મજબૂત રહ્યું છે અને મર્સિડિઝ તેમણે કહ્યું હતું કે, કંપની છે.એક્સક્લુઝિવ એડિશન ૧ની બેન્ચનાંભારતમાં કુલપૈકીનાં ૨૫ મર્સિડિઝ બેન્ઝ ઈન્ડિયા ખાસ ૧૬,૪૯૭ યુનિટ્સનું વેચાણ થયું ટીઈવી સેગમેન્ટને મજબૂત કરવા કિંમત રૂપિયા ૩.૮ કરોડથી શરૂ ટકા વેચાણોમાં તેનું યોગદાન થાય છે.મર્સિડિઝ બ્રાન્ડ પ્રત્યેની હોવાનું મર્સિડિઝ બેન્ઝ ઈન્ડિયાના ગ્રાહકોની અડગ નિષ્ઠા તથા એમડી તથા સીઈઓ સંતોષ ઐયરે

	લોડેંઝ ઇશ્વર હોટલ્સ લીમિટેડ રજી.ઓ.હોટલ રિવાઇવલ, સયાજી ગાર્ડન પાસે, કોલાઘોડા ચોક, યુનીવર્સીટી રોડ, વડોદરા. ગુજરાત ૩૯૦૦૦૨ ટેલિ.: ૦ રુક પ રબ્લ ૩૫૪૫ CIN: L55100GJ985PLC008264 ઇમેઇલ: info@lordsishwar.com ૩૧મી માર્ચ, ૨૦૨૪ના કેજ પૂરા થતા વિમારિક સત્ર અને વર્ષના અંતે ઓટિટેડ એકલ નાશાંકીય પરિશામોનો ઉતારો (રૂ. લાખમાં)									
	વિગતો	ત્રિમાસિક સત્ર અંતે ૩૧.૦૩.૨૦૨૪ (ઓડિટેડ)	વર્ષના અંતે ૩૧.૦૩.૨૦૨૪ (ઓડિટેડ)	ત્રિમાસિક સત્ર અંતે 3૧.૦૩.૨૦૨૩ (ઓડિટેડ)						
٩	કામગીરીથી કુલ આવક	૨૩૧.૧૧	956.23	201.02						
<del>ک</del>	સમયગાળા માટે ચોષ્ખો નક્ષે/(નુકસાન)(કરવેરા અપવાદરૂપ અને/અથવાઅસાધરણ વસ્તુઓ પહેલાં)	૨૬.૯૨	૪૫.૬૦	(૫.૧૨)						
ŝ	સમયગાળા માટે ચોખ્બો નફો/(નુકસાન)કરવેરા પહેલાં (અપવાદરૂપ અને/અથવા અસાધારણ આઇટમ પછી)		૪૫.૬૦	(૫.૧૨)						
8	સમયગાળા માટે ચોખ્ખો નકો / (નુકસાન) કર બાદ (અપવાદરૂપ અને/ અથવા અસાધારણ વસ્તુઓ પછી)	૨૫.૧૨	४୯.०२	(૯.૩૮)						
પ	કુલ વ્યાપક આવક સમયગાળા માટે (જેમાં નક્ષે / (નુકસાન) સમયગાળા માટે (કર બાદ) અને અન્ય વ્યાપક આવક(કર બાદ)	૨૫.૨૦	४୯.१०	(૭.૭૩)						
۶	ઇક્વિટી શેર મૂડી	989.00	989.00	989.00						
9	અનામત (પુનઃમુલ્યાંકન સિવાય રિઝર્વ તરીકે પાછલા બેલેન્સ શીટમાં બતાવ્યા પ્રમાણે)	-	(૧૯૨.૩૬)	-						
٢	શેરદીઠ આવક (દરેકના રૂા. ૧૦/-)(ચાલુ અને બંધ કામગીરીથી)									
	૧. મૂળભૂત	0.38	0.55	(०.१३)						
	૨. ભાળેલા	0.38	0.55	(0.93)						

**નોંદાઃ** ઉપરોક્ત ઉતારા સેબી (લિસ્ટિંગ ઓબ્લિગેશન્સ એન્ડ ડીસ્કલોઝર રિકવાયરમેન્ટસ) નિયમો ૨૦૧૫ના નિયમ ૩૩ મુજબ સ્ટોક એક્સચેન્જમાં દાખલ કરેલ ૩૧મી માર્ચ ૨૦૨૪ના રોજ ત્રિમાસિક સત્ર અને વર્ષના અંતે ઓડિટેંડ નાણાંકીય પરિણામો પ્રમાણે દર્શાવેલ છે. આ પરિણામોનું સંપૂર્ણ સ્વરૂપ સ્ટોક એક્સચેન્જની વેબસાઇટ www.bseindia.com અને કંપનીની વેબસાઇટ www.lordsishwar.com પર ઉપલબ્ધ છે.

લોડેંઝ ઘશ્વર હોટલ્સ લીમિટેડ વતી,

સહી

પુષ્પેન્દ્ર બંસલ

વહીવટી સંચાલક (DIN: 000૮૬૩૪૩)

સ્થળ : મુંબઇ તારીખ : ૨૩ મે, ૨૦૨૪

alf of the Board of Directors sd/-/iren Rathod naging Director

6.	Equity Share Capital	9827.92	9827.92	98
7.	Other Equity as shown in the Audited Balance Sheet			
8.				
	continuing operations-(not annualised)	(0.03)	(0.01)	
	2. Diluted:	(0.03)	(0.01)	
	Notes: The above is an extract of the detailed f Regulation 33 of SEBI (Listing and Other I Financial Results are available on the Stock (www.restile.com)	Disclosure Re	quirements) F	Regulat seindia



Extract of Consolidated Audited Financial Results for the Three Months and Year ended 31.03.2024

			Consol	Consolidated					
SL. No.	Particulars	3 months ended 31.03.2024	3 months ended 31.03.2023	Year ended 31.03.2024	Year ended 31.03.2023				
		Audited	Audited	Audited	Audited				
1.	Total Income from Operations	1807.15	1878.76	6856.58	6509.02				
2.	Profit before Interest, Depreciation & Taxes (EBITDA)	362.82	249.35	1120.26	896.23				
3.	Net Profit for the Period beforeTax & Exceptional Items	250.33	161.81	723.88	534.50				
4.	Net Profit for the Period before Tax (after Exceptional items)	250.00	161.81	732.49	534.48				
5.	Net Profit for the Period after Tax & Exceptional Items	162.06	114.83	487.87	369.11				
6.	Total Comprehensive Income for the period [Comprising Profit for the period (after tax) and other Comprehensive Income (after tax)]	165.34	111.64	490.41	367.81				
7.	Paid-up Equity Share Capital (Face value ₹5/- per share)	58.85	58.85	58.85	58.85				
8.	Reserves (excld. Revaluation Reserve)	3127.80	2745.01	3127.80	2745.01				
9.	Earnings Per Share (of ₹5/- each) (Not Annualised) Basic: Diluted:	13.34 13.34	9.35 9.35	40.10 40.10	30.48 30.48				

1. The Board has recommended a dividend of ₹6.50 per equity share (including interim dividend of ₹2.00 per equity share already paid) i.e. 130% for the financial year ended 31st March, 2024.

The above results have been reviewed by the Audit Committee and approved by the Board of Directors at their respective

### કલમ ૧૩(૪) હેઠળ. સિક્યોરીટી ઇન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) નિયમો, ૨૦૦૨ નો નિયમ ૮ (૧). (પરિશિષ્ટ ૪) જાત જણાવવાનું કે મેસર્સ બજાજ હાઉસિંગ કાચનાન્સ લીમીટેડ (બીએચએકએલ ) ના નીચે સહી કરનાર અધિકત અધિકારીએ સિક્યોરીટાઇઝેશન અને રીકન્સ્ટક્શ ઓફ ફાયનાન્સિયલ એસેટ્સ અને એન્ફોર્સમેન્ટ ઓફ સિક્યોરીટી ઇન્ટરેસ્ટ એક્ટ, ૨૦૦૨ હેઠળ અને સિક્યોરીટી ઇન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) નિયમો, ૨૦૦૨ ના નિયમ ૩ સાથે વંચાતી કલમ ૧૩(૨) દેઠળ મળેલ સત્તાનો ઉપયોગ કરીને અહીં નીચે જ્ણાવેલ દેવાદાર(રો)/સહ–દેવાદારો/જામીનદાર(રો) ને નોટીસમાં જણાવેલ ૨કમ જણાવેલ ે બેટીસ મળાવાની તારીખશી ૬૦ દિવસની એક્ટ ચુકવવા ભગાવ્યું હતું. દેવાદાર(રો)/સહ-દેવાદાર)/ જામીનદાર(રો) રકમની પૂર્નચુકવણી કરવામાં નિષ્ફળ ગયા છે, પરિણામે દેવાદાર(રો)/સહ-દેવાદારો/જામીનદાર(રો) અને જોટર બનતાને અહીં નોટીસ આપવામાં આવે છે કે મેસર્સ બજાજ હાઉસિંગ ફાયનાન્સ તીમીટેડના વતી નીચે સહી કરનારે સદર હું નિયમોના નિયમ ૮(૧) સાથે વંચાતા સદર હું કાયદાની કલમ ૧૩(૪) હેઠળ પ્રાપ્ત સત્તાનો ઉપયોગ કરીને અહીં નીચે જણાવેલ મિલકતનો કબજો મેળવી લીધો છે. પરિણામે ખાસ કરીને દેવાદાર(૨ો)/સહ-દેવાદારો/જામીનદાર(૨ો) અને જાહેર જનતાને નીચે જણાવેલ મિલકત સાથે સોદો ન કરવા સાવધ કરવામાં આવે છે અને જણાવેલ મિલકત સાથેનો કોઇપણ સોદો બીએચએફએલની અહીં જણાવેલ ૨કમ(મો) અને તેના પરના ચડત વ્યાજના પ્રથમ ચાર્જને આધિન રહેશે. દેવાદાર(રો)/જામીનદાર(રો) નું નામ ນເວເບເ ອງ ອາການ સિક્યોર્ડ મિલકત (સ્થાવર મિલકતની) ની વિગત (લોન એકાઉન્ટ નંબર, શાખાનું નામ) તારીખ અને રકમ ાખા : અમદાવાદ નીચેની બિન–ખેતીલાચક મિલકતના તમામ ભાગ 59-05-5058 (लोन नं. : H418HHL0187415 & અને હિસ્સા : ફ્લેટ નં. બી-૫૦૭, ઓમ શાંતિ **રૂા. ૧૪,૦૫,૯૦૬/–** (રૂપિચા ચૌદ લાખ પાંચ H418HLT0199673) રેસિડેન્સી, વિકુલ પ્લાઝા પાછળ, સ્વામી વિવેકાનંદ રોડ, હજાર નવસો છ પુરા) ૧. રાદ્યેશ્યામ ઝૂલાઇ ચાદવ (દેવાદાર) કલોલ, ગાંધીનગર-૩૮૨૭૨૧, પૂર્વ : લિફ્ટ અને સીડીઓ, પશ્ચિમ : ફ્લેટ નં. બી/૫૦૬, ઉત્તર : ફ્લેટ નં. એ/૫૯૧, દક્ષિણ : ફ્લેટ નં. બી/૫૦૩ અને ફ્લેટ નં. બી/૫૦૪ ૨. પ્રીતી સદ્યેશ્યામ ચાદવ (સહ–દેવાદાર) સરનામું : બી/૫૦૭, ઓમ શાંતિ રેસિડેન્સી, શુકન પાછળ, ક્લોલ, ગાંધીનગર–૩૮૨૭૨૧

સ્થળ : ગાંધીનગર, તારીખ : ૨૪.૦૫.૨૦૨૪



# LANDMARK CARS LIMITED

સહી/– અધિકૃત અધિકારી, બજાજ હાઉસિંગ ફાચનાન્સ લીમીટેડ

CIN: L50100GJ2006PLC058553

Regd. Office: Landmark House, Opp. AEC, S.G. Highway, Thaltej, Nr Gurudwara, Ahmedabad 380 059 Ph: +91 22 6271 9040 | Website: www.grouplandmark.in | E-mail: companysecretary@landmarkindia.net

				[₹ in Mill	lion, except pe			
	Quarter Ended Yea							
Sr. No	Particulars	31.03.2024	31.12.2023	31.03.2023	31.03.2024	31.03.2023		
		Unaudited	Unaudited	Unaudited	Audited	Audited		
1	Total income from operations	8,666.76	9,611.00	8,568.37	32,975.25	33,944.3		
2	Net profit for the period/year (before tax and exceptional items)	154.41	260.63	309.47	724.26	1,115.7		
3	Net profit for the period/year before tax (after exceptional items)	154.41	254.80	291.37	695.45	1,041.0		
4	Net profit for the period/year after tax (after exceptional items)	109.74	184.81	242.61	572.23	851.0		
5	Total comprehensive income for the period/year (comprising profit after tax and other comprehensive income/(loss)(after tax))	110.60	184.81	195.31	573.09	836.		
6	Equity share capital (Face value of ₹ 5/- each)	206.47	205.56	198.12	206.47	198.1		
7	Reserves (excluding revaluation reserve as shown in the Balance sheet)				5,182.97	4,499.2		
8	Earnings per share (Face value of ₹ 5/- each) (not annualised for the quarters)							
	Basic (In ₹)	2.67	4.45	6.11	13.82	22.5		
	Diluted (In ₹)	2.66	4.42	5.88	13.77	21.		
	EXTRACT OF STANDALONE AUDITED FINANCIAL R	SULTS FOR T	HE QUARTER	AND YEAR E	NDED MARCH	31, 2024		
					N	[₹ in Millio		
			Quarter Ended		Year	Ended		
Sr. No	Particulars	31.03.2024	31.12.2023	31.03.2023	31.03.2024	31.03.20		
		Unaudited	Unaudited	Unaudited	Audited	Audited		
1	Total income from operations	1,823.35	1,645.49	1,537.56	6,214.06	4,953.		
2	Profit before tax	199.52	194.20		389.82	678.		
3	Total comprehensive income for the period/year (comprising profit after tax and other	148.52	144.74	121.67	305.19	501.		

Notes:

### **RESTILE CERAMICS LIMITED**

Reg office: 204, Sakar Complex, Opp ABS tower, Vaccine Crossing, Old Padra Road, Vadodara, Gujarat-390015 CIN:L26931GJ1986PLC102350 EXTRACT OF AUDITED FINANCIAL RESULTS FOR THE YEAR ENDED MARCH 31, 2024

Sr.		C	Quarter Ende	Year Ended		
or. No.		31-Mar-24	31-Dec-23	31-Mar-23	31-Mar-24	31-Mar-23
			Unudited		Aud	dited
1.	Total Income from Operations	20.40	18.67	53.33	93.88	197.12
2.	Net Profit/(Loss) for the period (Before Tax and/or Exceptional items)	(28.62)	(11.05)	(36.77)	(91.10)	(66.85
3.	Net Profit/(Loss) for the period before Tax (after Exceptional items)	(28.62)	(11.05)	(36.77)	(91.10)	(66.85
4.	Net Profit/(Loss) for the period after Tax (after Exceptional items)	(28.62)	(11.22)	(36.77)	(91.27)	(66.85
5.	Total Comprehensive Income for the period [Comprising Profit/(Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	(28.32)	(11.35)	(36.35)	(90.82)	(66.28
6.	Equity Share Capital	9827.92	9827.92	9827.92	9827.92	9827.9
7.	Other Equity as shown in the Audited Balance Sheet				(12,898.91)	(12,808.09
8.	Earnings per share (of Rs. 10/- each) for continuing operations-(not annualised) 1. Basic: 2. Diluted:	(0.03) (0.03)	(0.01) (0.01)	(0.04) (0.04)	(0.09) (0.09)	(0.07 (0.07
		(0.03) ormat of Fir Disclosure Re	(0.01) ancial Result quirements) F	(0.04) ts Filed with Regulations, 2	(0.09) the Stock Ex 015. The ful	I form

- The above results have been reviewed by the Audit Committee and approved by the Board of Directors in their meeting held on May 23, 2024.
- The dealership agreement of the Parent and Landmark Cars (East) Private Limited ("LCEPL"), one of its subsidiary Company 2 for sale of new cars with Mercedes-Benz India Private Limited ("MBIL") had materially changed and converted to an agency model whereby all new cars ales are made directly to customers by MBL. Under the agency agreement, customers now place orders through the Group directly to MBL on which group earns commission on each sale of Mercedes-Benz cars. The value of cars sold by Parent and LCEPL on behalf of Mercedes-Benz on which commission income is recognised as below:

					[₹ In Million]
	Quarter Ended			Year Ended	
Particulars	31.03.2024	31.12.2023	31.03.2023	31.03.2024	31.03.2023
Value of cars sold by Parent and LCEPL on behalf of Mercedes-Benz on which only commission income is recognised		3,665.91	3,266.16	14,634.46	12,970.26

During the year ended March 31, 2024, exceptional items represents the net impact of loss on discard of immovable 3 property, plant and equipment and gain on termination of lease on account of closure of showroom and workshop of Renault and in Patiala and replacing small workshop with a larger workshop of Jeep brand in West Delhi.

During the previous year ended March 31, 2023, exceptional items represents the net impact of loss on discard of immovable property, plant and equipment along with liquidated damages on termination of lease and gain on termination of lease on account of closure of 7 non-viable outlets of Renault dealership in Punjab and Haryana, replacing small workshop with a much larger workshop of Mercedes-Benz in Kolkata and relocating showroom of Mercedes-Benz in Gujarat for the strategic advantage.

- During the year ended March 31, 2024, due to change in the business outlook of the Renault operations in India and closure of several locations in recent past, the Parent has reassessed the recoverable value of its investments and loans given to Benchmark Motors Private Limited, a wholly-owned subsidiary. Consequently, the Parent has written off loans given amounting to ₹ 384.55 million and shown as exceptional item in the standalone audited financial results.
- The above is an extract of the detailed format of the Standalone and Consolidated Audited Financial Results for the quarter and year ended March 31, 2024 filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing and Other Disclosures Requirements) Regulations, 2015. The full format of these Financial Results are available on the Stock Exchange websites, www.nseindia.com, www.bseindia.com and on the Company's website www.grouplandmark.in.

Place: Mumbai Date: May 23, 2024

For and on behalf of the Board of Directors Sanjay K. Thakker **Chairman and Executive Director** DIN:00156093

meetings held on 23rd May, 2024

3. Standalone financial information of the company, pursuant to Regulation 47(1)(b) of SEBI (LODR):

Particulars	3 months ended 31.03.2024	3 months ended 31.03.2023	Year ended 31.03.2024	Year ended 31.03.2023
Total Income from Operations	1665.77	1746.66	6383.78	6133.28
Operating Profit (EBITDA)	293.44	206.89	927.76	766.50
Profit before Tax & Exceptional items	223.32	137.27	645.56	481.46
Profit before Tax (after Exceptional Items)	223.32	137.27	645.56	481.46
Net Profit for the Period after tax & Exceptional Items	142.35	97.32	424.32	330.77

4. The above is an extract of the detailed format of quarter ended 31st March, 2024. Financial results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the standalone & consolidated guarterly financial results are available on the websites of Stock Exchanges at www.bseindia.com and www.nseindia.com and also on the company's website at www.jklakshmicement.com.

### Place: New Delhi Date: 23rd May, 2024

Vinita Singhania (Chairperson & Managing Director)

Shareholders holding shares in physical mode are requested to dematerialise them and complete their KYC.



PRO

PLATINUM CEMENT

JKLAKSHMI JKLAKSHMI JKLAKSHMI JKLAKSHMI JKLAKSHMI

Admin Office: No. 4, Nehru House, Bahadur Shah Zafar Marg, New Delhi - 110002 | Regd. Office: Jaykaypuram - 307019, Dist. Sirohi, Rajasthan Website: jklakshmicement.com | E-mail: jklc.investors@jkmail.com | Fax No.: 91-011-23722251 | CIN: L74999RJ1938PLC019511

